

Article Date	Headline / Summary	Publication
17 Aug 2026	Sponsor Protection Rider Strengthens Travel Insurance for Students	Financial Express (Gujarati)

વીમા ક્ષેત્ર

સ્પોન્સર પ્રોટેક્શન રાઇડર વિદ્યાર્થીઓ માટે પ્રવાસ વીમાને મજબૂત બનાવે છે

સૈકત નિયોગી

જો તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું આયોજન કરી રહ્યા છો, તો વિદ્યાર્થી પ્રવાસ વીમા સાથે પ્રાયોજક સુરક્ષા લાભ જરૂરથી લેવો જોઈએ. આ લાભ તમારા પ્રાયોજક, સામાન્ય રીતે માતા અથવા પિતા,નું અકસ્માતને કારણે મૃત્યુ થાય અથવા તેઓ કાયમી અપંગ બને તો તમારા અભ્યાસને આર્થિક સુરક્ષા આપે છે. વિદેશમાં અભ્યાસ કરવો ભારતીય પરિવારો માટે સૌથી મોટા આર્થિક રોકાણોમાંનું એક છે. આ ખર્ચ સામાન્ય રીતે પરિવારની બચત અથવા શિક્ષણ લોન દ્વારા ઉઠાવવામાં આવે છે. તેથી પ્રાયોજકની આર્થિક સ્થિતિ તમારા અભ્યાસ માટે ખુબ મહત્વની બને છે.

બજાજ જનરલ વીમાના રિટેલ વ્યવસાયના મુખ્ય વિતરણ અધિકારી રાકેશ કૌલના જણાવ્યા મુજબ, જો પ્રાયોજક પોલિસીમાં આવરી લેવાયેલી કોઈ અણધારી ઘટનાના કારણે વિદ્યાર્થીના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા સક્ષમ ન રહે, તો આ લાભ વિદ્યાર્થીને આર્થિક સહાય આપે છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ મુશ્કેલ સમયમાં વિદ્યાર્થીઓને નાણાંની ચિંતા કર્યા વગર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બને છે.

સામાન્ય વિદ્યાર્થી પ્રવાસ વીમામાં તબીબી કટેકટી, હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ અને પ્રવાસ દરમિયાન ઊભા થતા કેટલાક જોખમોનો સમાવેશ થાય છે. કેટલીક વીમા કંપનીઓ વિદ્યાર્થી પ્રવાસ વીમામાં પ્રાયોજક સુરક્ષાનો લાભ પહેલેથી જ સમાવતી હોય છે. આ ઉપરાંત, જો તમારા કારણે કોઈ વ્યક્તિને ઇજા થાય અથવા કોઈની મિલકતને

નુકસાન પહોંચે તો કાનૂની જવાબદારીનો ખર્ચ ચૂકવતો વ્યક્તિગત જવાબદારી લાભ અને તમે હોસ્પિટલમાં દાખલ થાઓ ત્યારે પરિવારના સભ્યના પ્રવાસ ખર્ચની ભરપાઈ કરતો આકસ્મિક પારિવારિક મુલાકાત લાભ પણ ઉપયોગી વિકલ્પો છે.

યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતું આરોગ્ય વીમા આવરણ

વિદેશની ઘણી યુનિવર્સિટીઓ, ખાસ કરીને અમેરિકાની, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી આરોગ્ય વીમા યોજનામાં જોડાવું ફરજિયાત બનાવે છે. આ યોજના મુખ્યત્વે અભ્યાસ દરમિયાન જરૂરી તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા માટે હોય છે. આ યોજનાઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, તાત્કાલિક સારવાર, બહારથી લેવાતી તબીબી સલાહ તેમજ જરૂર પડે ત્યારે તબીબી સ્થળાંતર અથવા વતનમાં પરત મોકલવાની સુવિધાનો સમાવેશ થાય છે. પોલિસીબજારના પ્રવાસ વીમા વિભાગના વડા માનસ કપૂરના જણાવ્યા મુજબ, યુનિવર્સિટીનું વીમા આવરણ વિદ્યાર્થીઓને વિદેશમાં રહેતા સમયે ઊભા થઈ શકતા અનેક પ્રવાસ અને આર્થિક જોખમોથી સુરક્ષા આપતું નથી.

તેમના જણાવ્યા પ્રમાણે, ભારતમાંથી લેવાયેલ વિદ્યાર્થી પ્રવાસ વીમો યુનિવર્સિટી વીમાની સાથે વધારાનું અને વધુ વ્યાપક રક્ષણ આપે છે. ભારતમાંથી લેવાયેલ વિદ્યાર્થી પ્રવાસ વીમામાં યુનિવર્સિટી નેટવર્કની બહારની તબીબી કટેકટી, તબીબી સ્થળાંતર અને વતનમાં પરત મોકલવાનો ખર્ચ, પ્રવાસ રદ થવો અથવા વચ્ચે અટકી જવો, પાસપોર્ટ ગુમાવવો અથવા નોંધાયેલ સામાન ખોવાઈ જવો

STUDY ABROAD

- Base student travel insurance covers medical emergencies, hospitalisation & some travel-related risks
- Personal liability and emergency family visit add-ons are important riders
- University insurance does not protect against several travel-related and financial risks that can arise while studying abroad
- Financial wellbeing of sponsor—parent or guardian—is essential for a student's academic future

જેવા જોખમોનો પણ સમાવેશ થઈ શકે છે. આથી વિદ્યાર્થીને માત્ર તબીબી જ નહીં, પરંતુ અન્ય અણધારી પરિસ્થિતિઓમાં પણ આર્થિક સુરક્ષા મળે છે.

કેટલું વીમા આવરણ લેવું?

વીમા આવરણની રકમ નક્કી કરતી વખતે માત્ર પ્રીમિયમ નહીં, પરંતુ જે દેશમાં અભ્યાસ માટે જઈ રહ્યા છો ત્યાંના આરોગ્ય સારવારના ખર્ચને ધ્યાનમાં લેવો જોઈએ. વૈશ્વિક સહાય અને પ્રવાસ વીમા સેવા આપતી કંપનીના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી દેવ કરવતના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓએ સૌપ્રથમ પોતાની યુનિવર્સિટીએ નક્કી કરેલા લઘુત્તમ વીમા ધોરણો સમજવા જોઈએ, ખાસ કરીને જો તેઓ યુનિવર્સિટીની આરોગ્ય વીમા યોજનામાંથી મુક્તિ મેળવવા માંગતા હોય.

